

RAN-2408000602030003
F.Y.B.Com. (Semester-II) Examination March - 2026
Minor-Elements of Banking and Insurance Paper-II
Time: 2 Hours]
[Total Marks: 50

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવલી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book. (2) જમણી બાજુના અંક પ્રશ્નના પૂરા ગુણ દર્શાવે છે. Figures to the right indicate full marks of the question.	Seat No.: Student's Signature
--	---

- પ્ર-1. નીચેના પ્રશ્નોનાં ટૂંકમાં જવાબ આપો (કોઈ પણ પાંચ) 10**
- 1) બેકિંગમાં આંતરિક સંચાલન પદ્ધતિનો અર્થ સમજાવો.
 - 2) ચેકની વ્યાખ્યા આપો.
 - 3) એ.ટી.એમ. નો અર્થ સમજાવો.
 - 4) ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ વચ્ચે તફાવત શું છે?
 - 5) સામાન્ય ક્રોસિંગ એટલે શું?
 - 6) એન.એફ.એસ. ની વ્યાખ્યા આપો.
 - 7) ઈ-કેવાયસી નો અર્થ સમજાવો.
- પ્ર-2. ઈન્ટરનેટ બેકિંગ એટલે શું? ઈન્ટરનેટ બેકિંગના લાભો વિષે વિસ્તૃત ચર્ચા કરો. 14**
- અથવા**
- પ્ર-2. અ) માઈક્રર ચેક અંગે નોંધ લખો. 07**
- બ) ક્રેડિટ કાર્ડના લાભો વર્ણવો. 07**
- પ્ર-3. નેશનલ ઓટોમેટેડ કિલીયરીંગ હાઉસના મુખ્ય પડકારોની ચર્ચા કરો. 14**
- અથવા**
- પ્ર-3. અ) મોબાઈલ બેકિંગની વિશેષતાઓ વર્ણવો. 07**
- બ) જોખમ સંચાલન અને છેતરપિંડી સમજાવો. 07**
- પ્ર-4. ટૂંકનોંધ લખો. (કોઈ પણ બે) 12**
- 1) ચેકના લક્ષણો.
 - 2) રૂપે કાર્ડ.
 - 3) નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર.
 - 4) સીક્યોરીટીઝ સેટલમેન્ટ.

ENGLISH VERSION

Q-1.	Answer the following questions briefly: (any five)	10
1)	Explain the meaning of back-end operation system.	
2)	Give the definition of cheque.	
3)	Explain the meaning of ATM.	
4)	What is the difference between debit card and credit card.	
5)	What is general crossing?	
6)	Give the definition of NFS.	
7)	Explain the meaning of E-KYC.	
Q-2.	What is internet banking? Discuss the benefits of internet banking in detail.	14
	OR	
Q-2.	a) Write a note on MICR cheque.	07
	b) Describe the benefits of credit card.	07
Q-3.	Discuss the main challenges of National Automated Clearing House.	14
	OR	
Q-3.	a) Describe the features of mobile banking.	07
	b) Explain the risk management and frauds.	07
Q-4.	Write short notes: (any two)	12
1)	Characteristics of cheque.	
2)	RuPay card.	
3)	National Electronic fund transfer.	
4)	Securities Settlement.	